

SPARC/Sec/SE/2023-24/86

February 09, 2024

National Stock Exchange of India Ltd., Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051.

Scrip Symbol: SPARC

BSE Limited,
Market Operations Dept.
P. J. Towers,
Dalal Street,
Mumbai - 400 001.

Scrip Code: 532872

Dear Sir/ Madam,

Sub: Disclosure under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to the provisions of Regulation 47 of the Listing Regulations, please find enclosed the copies of advertisement published on February 06, 2024, the extract of Unaudited Financial Results (Standalone and Consolidated) of the Company for the quarter and nine-months ended December 31, 2023, in Financial Express (English Newspaper) all Editions and Financial Express (Gujarati Newspaper) Ahmedabad Edition.

A copy of the newspaper clippings are attached herewith. These are also being made available on the website of the Company at www.sparc.life

This is for your information and record.

For Sun Pharma Advanced Research Company Ltd.

Kajal Damania
Company Secretary and Compliance Officer

Encl: as above

Sun Pharma Advanced Research Company Limited

Regd. Office: Plot No. 5 & 6/1, Savli, G. I. D. C. Estate, Savli - Vadodara Highway, Manjusar, Vadodara - 391 775. Tel.: +91-2667 666800, CIN: L73100GJ2006PLC047837, Website: www.sparc.life

Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2023

T		ended ended 31.12.2023 30.09.202 Unaudited Unaudite 2,025 2,967 (9,965) (8,642) (9,965) (8,642) (9,965) (8,642)	tated				
Sr.	Particulars		Quarter ended		Year ended	6.30 (10.00) (10.00)	Half Year ended
No.	T di liculais.	31.12.2023 Unaudited	30.09.2023 Unaudited	31.12.2022 Unaudited	31.03.2023 Audited	COLUMN TO SERVICE DE LA COLUMN	30.09.2023 Unaudited
1.	Total Income from Operations	2,025	2,967	13,112	24,966	2,025	2,967
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
3.	Net Profit / (Loss) for the period (before Tax and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
4.	Net Profit / (Loss) for the period (after Tax and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(9,931)	(8,608)	1,057	(22,123)	(9,931)	(8,608)
6.	Paid up Equity Share Capital	3,245	3,245	2,753	3,245	3,245	3,245
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	4909000	-10000	1,250,250,00	48,032	-302500	
8.	Basic Earning / (Loss) Per Share (of ₹ 1 each) (for continuing and discontinued operations)	(3.07)	(2.66)	0.37	(7.82)	(3.07)	(2.66)
9.	Diluted Earning / (Loss) Per Share (of ₹ 1 each) (for continuing and discontinued operations)	(3.07)	(2.66)	0.35	(7.82)	(3.07)	(2.66)

) The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for Quarter ended December 31, 2023 are available on the websites of the Stock Exchanges viz.www.bseindia.com, www.nseindia.com and of the Company viz. www.sparc.life

ii) There were no deviations in the utilisation of the funds raised through the Preferential Issue of warrants convertible into equity shares of the Company, from the objects as specified in the Notice of Extra-Ordinary General Meeting dated May 12, 2021,

> For and on behalf of the Board Dilip S. Shanghvi

> > Chairman

Mumbai, February 5, 2024

NOTICE

Declaration of Distribution (of Income & Capital) (previously referred as Dividend) Under Various Schemes of Axis Mutual Fund: Axis Mutual Fund Trustee Limited, Trustee to Axis Mutual Fund ("the Fund") has approved the declaration of Distribution (of Income & Capital) (previously referred as dividend) under the Income Distribution cum Capital Withdrawal (IDCW) option(s) of following schemes of Axis Mutual Fund, the particulars of which are as under:

Name of the Scheme(s)/ Plan(s)	Quantum of IDCW (₹ per unit)°	Record Date*	Face Value (₹ per Unit)	
Axis Bluechip Fund - Direct Plan - IDCW Option	1.00		5	25.06
Axis Bluechip Fund - Regular Plan - IDCW Option	1.60)		18.72
Axis Focused 25 Fund - Regular Plan - IDCW Option	1.75	February	10	19.76
Axis Focused 25 Fund - Direct Plan - IDCW Option	3.00	08, 2024	10	34.66
Axis Equity Saver Fund - Regular Plan - Regular IDCW Option	1.15			13.53
Axis Equity Saver Fund - Direct Plan - Regular IDCW Option	1.15			14.01

As reduced by the amount of applicable statutory levy, if any.

or the immediately following Business Day if that day is not a Business Day.

Pursuant to payment of IDCW, the NAV of the above stated IDCW option(s) of the scheme(s)/plan(s) would fall to the extent of payout and statutory levy, if any.

The Distribution would be paid to the beneficial owners / unit holders whose names appear in the statement of beneficial owners maintained by the depositories under the said scheme(s)/plan(s) at the close of business hours on the record date and to the unit holders holding units in physical form, whose names appear in the Register of unit holders maintained with Registrar and Transfer Agent under the IDCW option(s) of the scheme(s)/plan(s) as at the close of the business hours on the record date. Investors may kindly note that declaration of Distribution is subject to availability of distributable surplus on the record date/ex-

distribution date. In case the distributable surplus is less than the quantum of Distribution on the record date/ex-distribution date, the entire available distributable surplus in the aforesaid scheme(s)/plan(s) will be declared as Distribution. Investors are requested to kindly take note of the above.

> For Axis Asset Management Company Limited (CIN - U65991MH2009PLC189558) (Investment Manager to Axis Mutual Fund)

> > (Rs. in Lakhs)

Place: Mumbai Date: February 05, 2024 Gop Kumar Bhaskaran No.: 119/2023-24 Managing Director & Chief Executive Officer

Statutory Details: Axis Mutual Fund has been established as a Trust under the Indian Trusts Act, 1882, sponsored by Axis Bank Ltd. (liability restricted to ₹ 1 Lakh). Trustee: Axis Mutual Fund Trustee Limited Investment Manager: Axis Asset Management Company Limited (the AMC) Risk Factors: Axis Bank Ltd. is not liable or responsible for any loss or shortfall resulting from the operation of the schemes.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



Axis House, First Floor, C2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025, India. TEL: (022) 4325-5161, FAX: (022) 4325-5199, EMAIL: customerservice@axismf.com, WEBSITE: www.axismf.com, CONTACT NUMBER: 8108622211



GFL LIMITED

Registered office: 7th Floor, Ceejay House, Dr. Annie Besant Road, Worli, Mumbai - 400 018 CIN: L65100MH1987PLC374824 • Tel. No.: +91- 22 4032 3851 • Fax No.: +91- 22 4032 3191 Website: www.gfllimited.co.in • Email ID: contact@gfllimited.co.in

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED AND NINE MONTHS ENDED 31 DECEMBER 2023

Sr. No.	Particulars	Quarter ended 31.12.2023 (Unaudited)	Nine Month ended 31.12.2023 (Unaudited)	Quarter ended 31.12.2022 (Unaudited)
1	Total Income from operations	81	264	91
2	Net Profit for the period before tax from continuing operations (Before exceptional Items)	172	1,489	11
3	Net Profit for the period before tax from continuing operations (After exceptional Items)	172	1,489	11
4	Net Profit for the period after tax from continuing operations (After exceptional Items)	144	1,292	*
5	Profit / (Loss) for the period from discontinued operations after tax	원활기		(4,042)
6	Profit /(Loss) for the period	144	1,292	(4,042)
7	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period after tax and Other Comprehensive Income after tax)	154	1,290	(4,041)
8	Paid-up equity share capital (face value Rs. 1 per share)	1,099	1,099	1,099
9	Basic and Diluted Earnings/(Loss) per share (face value of Rs.1/- each)			
	From continuing operations	0.14**	1.18**	#
	From discontinued operations	200	8	(3.68)**
	From total operations	0.14**	1.18**	(3.68)**

* Amount is less than ₹ 1 lakh

**not annualized

#Less than Rs. 0.01

Place: New Delhi

financialexp.epapr.in

Date: 5 February 2024

- 1. The above results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors at its meeting held on 5 February 2024. The Statutory Auditors of the Company have carried out the Limited review of the above results and have issued their unmodified review report.
- The above results are an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited Quarterly standalone and consolidated Financial Results are available on the Stock Exchanges' website (www.bseindia.com and www.nseindia.com) and on the

Company's website (www.gfllimited.co.in). 3. Information on Standalone Financial Results:

		Quarter ended	Nine months Ended	ed) (Unaudited) 240 84
Sr.	Particulars	31.12.2023	31.12.2023	The second residence of the se
No.	A 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1	(Unaudited)	(Unaudited)	
1	Total income from operations	74	240	84
2	Net Profit for the period before tax (After exceptional Items)	47	139	9
3	Net Profit for the Period after tax (After exceptional Items)	35	103	1

On behalf of the Board of Directors For GFL Limited

Devendra Kumar Jain

Chairman & Managing Director

SPA CAPITAL SERVICES LIMITED

Registered Office: 25, C- Block, Community Centre, Janakpuri, New Delhi - 110058 Website: http://www.spacapital.com/CapitalServices/ CIN: L65910DL1984PLC018749, Tel No. 011-45586600, 45675500, E-Mail Id: listing@spacapital.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE NINE MONTHS AND QUARTER ENDED 31.12.2023 (Rs. In crores except for Shares and EPS)

S. No.	Particulars	Quarter Ended			Nine Months Year Ended Ended		Quarter Ended		d	Nine Months Ended	Year Ended
		31.12.2023 Unaudited Reviewed	30.09.2023 Audited	31.12.2022 Unaudited Reviewed	31.12.2023 Unaudited Reviewed	31.03.2023 Audited	31.12.2023 Unaudited Reviewed	30.09.2023 Audited	31.12.2022 Unaudited Reviewed	31.12.2023 Unaudited Reviewed	31.03.2023 Audited
1	Total Income from Operations (net)	50.000 500 5100					*-W*-00000000		W-0412-0000000		-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.126	0.135	0.033	0.3701	0.347	0.126	0.135	0.033	0,3701	0.346
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.126	0.135	0.033	0.3701	0.347	0.126	0.135	0.033	0.3701	0.346
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.172	0.095	0.023	0.3556	0.273	0.172	0.095	0.023	0.356	0.273
5	Total Comprehensive Income for the period [Comprising Profits /(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	0.172	0.095	0.023	0.3556	0.273	0.19	0.141	0.09	0.446	0.439
6	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	13.407	13.235	12.887	13.407	13.051	13.611	13.421	12.915	13.611	13.165
7	Equity Share Capital (Face Value of Rs.10/- each)	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225	30,74,225
8	Earnings Per Share Basic: Diluted:	0.559 0.559	0.309 0.309	5288,070	1.157 1.157	0.889 0.889	0.62 0.62	0.46 0.46	0.33 0.33	1.45 1.45	1.43 1.43

Place: New Delhi

1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter and nine months ended 31.12.2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI Listing Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and nine months ended 31.12.2023 is available on the website of Stock Exchange at (www.bseindia.com) as well as on the Company's Website at https://www.spacapital.com/CapitalServices/.

The Financial Results of the Company for the Quarter and nine months ended 31.12.2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 05.02.2024 and the same have been reviewed by the Statutory Auditor in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The Financial results have been prepared in accordance with Ind AS prescribed under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian

The figures for the quarter and nine months ended 31.12.2023 are the balancing figures between the annual audited figures for the year then ended and the year to date figures for the period ended 31.12.2023 which is approved by the Board of Directors of the Company and subjected to limited review by the statutory auditor.

For and on behalf of Board of Directors Sandeep Parwal

Chairman Cum Managing Director

DIN: 00025803

Dated: 06.02.2024

GIC HOUSING FINANCE LTD.

YOUR ROAD TO A DREAM HOME

CIN: L65922MH1989PLC054583

Regd. Office: 6th Floor, National Insurance Building, 14, Jamshedji Tata Road, Churchgate, Mumbai - 400 020. | Website: www.gichfindia.com

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023

(₹ in Lakh)

_	ri -			**	- 35
Sr. No	PARTICULARS	Quarter Ended (31/12/2023)	Quarter Ended (31/12/2022)	Year to Date (31/12/2023)	Previous Year Ended (31/03/2023)
5		(Reviewed)	(Reviewed)	(Reviewed)	(Audited)
1	Total Income from operations	26,289	28,428	80,411	1,12,888
2	Net Profit/(Loss) for the period (before tax,				
	Exceptional and/or Extraordinary items)	4,230	8,821	12,481	28,980
3	Net Profit/(Loss) for the period before tax	1/725992	F-5237	92970534	15500000
625	(after Exceptional and/or Extraordinary Items)	4,230	8,821	12,481	28,980
4	Net Profit/(Loss) for the period after tax	200 C 500 C	-0000000-00-000 5986-04000000	0.0000000000000000000000000000000000000	10/2/03/2010
0800	(after Exceptional and/or Extraordinary items)	3,560	6,541	9,757	21,320
5	Total Comprehensive Income for the period		100	165	
	[Comprising Profit/(Loss) for the period (after tax)			5.1.a. 2000000	THE CONTRACTOR
	and Other Comprehensive Income (after tax)]	3,708	6,504	9,942	21,272
6	Paid up Equity Share Capital (Face value ₹ 10/-)	5,385	5,385	5,385	5,385
7	Reserves as at 31st March (Audited)	1,64,543	1,45,694	1,64,543	1,64,543
8	Securities Premium Account	11,699	11,699	11,699	11,699
9	Net Worth (Audited)	1,69,931	1,51,082	0.6534500034650034650	1,69,931
10	Paid up Debt capital/Outstanding Debt	8,54,594	9,49,913	8,54,594	9,14,272
11	Outstanding Redeemable Preference Shares				90,000
12	Debt Equity Ratio	4.82	5.76	4.82	5.38
13	[[마다] [[nt]				
	(a) Basic	6.61	12.15	18.12	39.59
	(b) Diluted	6.61	12.15	18.12	39.59
\$850		Not Annualised	Not Annualised	Not Annualised	Annualised
14	67470 165 17677 187 186 17670 17670 1	n er we ell	serve way"	and a second	and the same of the
15	Debenture Redemption Reserve	Not Applicable		Not Applicable	Not Applicable
16	Debt Service Coverage Ratio	Not Applicable	EXCELS 10 COLD FOR SALE THE SOURCE STATE OF THE COLD	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable

Notes:

- (a) The above is an extract of the detailed format of unaudited standalone financial results for the guarter and nine months ended December 31, 2023 filed with National Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited standalone financial results are available on the National Stock Exchange of India Ltd. website (URL: https://www.nseindia.com), BSE Limited website (URL: https://www.bseindia.com) and on the website of the Company (URL: https://www.gichfindia.com).
- (b) In compliance with Regulation 33 and Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the above unaudited Standalone Financial Results for the guarter and nine months ended December 31, 2023 have been reviewed by the Statutory Auditors of the Company, reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meeting held on February 05, 2024.
- and available on the National Stock Exchange of India Ltd. website (URL: https://www.nseindia.com), BSE Limited website (URL: https://www.bseindia.com) (d) There are no changes in the accounting policies for the quarter and nine months ended December 31, 2023 and there

(c) For the other line items referred in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made

- is no impact on net profit/loss, total comprehensive income or any other relevant financial item.
- (e) The figures for the previous periods / year have been regrouped / reclassified wherever necessary in order to make them comparable with figures for the guarter and nine months ended December 31, 2023.

STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE **QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023**

(₹ in Lakh)

Sr. No	PARTICULARS	Quarter Ended (31/12/2023)	Quarter Ended (31/12/2022)	Date year	
5		(Reviewed)	(Reviewed)	(Reviewed)	(Audited)
1	Total Income from operations	26,290	28,429	80,414	1,12,890
2	Net Profit/(Loss) for the period (before tax,				
	Exceptional and/or Extraordinary items)	4,236	8,824	12,495	28,985
3	Net Profit/(Loss) for the period before tax	0.000 P.O.	P14050	00000000	52/10/A/A
7396	(after Exceptional and/or Extraordinary Items)	4,236	8,824	12,495	28,985
4	Net Profit/(Loss) for the period after tax	100/05/000	NYAPATAN G-MANAGAN	.005200535080 .005500.005	ANNIAGECTÀ
	(after Exceptional and/or Extraordinary items)	3,565	6,544	9,768	21,325
5	Total Comprehensive Income for the period	12			54
	[Comprising Profit/(Loss) for the period (after tax)				
	and Other Comprehensive Income (after tax)]	3,713	6,507	9,953	21,277
6	Paid up Equity Share Capital (Face value ₹ 10/-)	5,385	5,385	5,385	5,385
7	Reserves as at 31st March (Audited)	1,64,542	1,45,688	1,64,542	1,64,542
8	Securities Premium Account	11,699	11,699	11,699	11,699
9	Net Worth (Audited)	1,69,930	1,51,076	1,69,930	1,69,930
10	Paid up Debt capital/Outstanding Debt	8,54,594	9,49,913	8,54,594	9,14,272
11	Outstanding Redeemable Preference Shares		31 09		A 14
12	Debt Equity Ratio	4.82	5.77	4.82	5,38
13	Earning Per Share (EPS) on Face Value ₹ 10/-				
	(a) Basic	6.62	12.15	18.14	39.60
	(b) Diluted	6.62	12.15	18,14	39.60
52000	1988 10016028000 89 9040	Not Annualised	Not Annualised	Not Annualised	Annualised
14	Capital Redemption Reserve	ACALORES CARO NOT		30000 100 100 1000 B	VENTURE TIME PRO
15		Not Applicable		Not Applicable	
16	[17] C.	Not Applicable		Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable

- (a) The above is an extract of the detailed format of unaudited consolidated financial results for the quarter and nine months ended December 31, 2023 filed with National Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited consolidated financial results are available on the National Stock Exchange of India Ltd. website (URL: https://www.nseindia.com), BSE Limited website (URL: https://www.bseindia.com) and on the
- (b) In compliance with Regulation 33 and Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the above unaudited Consolidated Financial Results for the guarter and nine months ended December 31, 2023 have been reviewed by the Statutory Auditors of the Company, reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meeting held on
- (c) For the other line items referred in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made and available on the National Stock Exchange of India Ltd. website (URL: https://www.nseindia.com), BSE Limited website (URL: https://www.bseindia.com) (d) There are no changes in the accounting policies for the quarter and nine months ended December 31, 2023 and there
- is no impact on net profit/loss, total comprehensive income or any other relevant financial item. (e) The figures for the previous periods / year have been regrouped / reclassified wherever necessary in order to make

them comparable with figures for the quarter and nine months ended December 31, 2023.

For and on behalf of the Board Sd/-

Paul Lobo Managing Director & CEO

DIN No: 09787223

Place : Mumbai Date: February 05, 2024

website of the Company (URL: https://www.gichfindia.com).

DIN: 00029782

ફોર્મ નંબર યુઆરસી-૨

અધિનિયમના પ્રકરણ ૨૧ ના ભાગ ૧ હેઠળ નોંધણી અંગે નોટિસ આપતી જાહેરાત [કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૩७૪ (બી) ને અનુલક્ષીને અને કંપની (નોંધણી માટે અધિકૃત) નિયમ, ૨૦૧૪ ના નિયમ ((૧)]

૧. કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૩૬૬ ની પેટા કલમ (૨) ને અનુસરીને અહીં નોટિસ આપવામાં ઝાવે છે કે, મેસર્સ પહલ સોલાર, એક પાર્ટનરશીપ ફર્મ, આ નોટિસ પ્રસિદ્ધ થયેના પંદર દિવસ પછી પરંતુ શ્રીસ દિવસની પૂર્વે સેન્દ્રલ ૨જિસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી) ને કંપની એક્ટ ૨૦૧૩ ના પ્રકરણ રવે ના ભાગ ૧ હેઠળ રજિસ્ટર કરવા માટે અરજી કરવામાં આવશે કે જે કંપની શેર દ્વારા

૧૩.... ૨.કંપનીના મુખ્ય હેતુ નીચે મુજબ છે:- ઉત્પાદન , ઉત્પાદન , પ્રક્રિયા , ઉત્પાદન , સંચયનો વ્યવસાય ચાલુ રાખવા માટે, સલાહકાર, આચાતકારો તરીકે વિતરણ. સ્થાનાંતરિત, જાળવણી, મિશ્રણ, સપ્લાય, કરાર, નિકાસકારો, ખરીદદારો, વિક્રેતાઓ, એસેમ્બલર્સ, ભાડે લેનારા, રિપેરર્સ, ડીલર્સ, વિતરકો, સ્ટોકિસ્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, નોકરી કરનારા, વેપારીઓ, એજન્ટો, દલાલો, પ્રતિનિધિઓ, સહયોગીઓ અથવા મર્ચન્ડાઇઝિંગ, માર્કેટિંગ, મેનેજિંગ, લીઝિંગ, ભાડે આપવું, કોઇપણ પ્રકારની વીજળી અથવા ઊર્જાનો ઉપયોગ રિન્થુએબલ અથવા ગ્રીન એનર્જી, સ્ટીમ, પાવર, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, બાચોમાસ સહિત ઊર્જા, ભૂઉમીચ ઊર્જા, હાઇડલ ઊર્જા, ભરતી અને તરંગ ઊર્જા અને અન્થ પરંપરાગત, બિન ભારતમાં અને

ભારતની ળહાર પરંપરાગત અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો. 3. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશનના લેખોની નકલ , પ્લોટ નં. ૧૬७ થી ૧७૩, ૧૦૦ થી ૧૮૯, ૧૯ અને ૨૨, ૦લોક નં. ૭૧ અને ૭૨, સામે. શિવ શક્તિ એસ્ટેટ, ઓલપાડ સાયન રોડ , ઓલપાડ , સુરત-૩૯૪૫૪૦ , ગુજરાત પરની ઓફિસ ઉપર જોઈ શકાશે. ૪ . અહીં નોટિસ આપવામાં આવે છે કે આ અરજી સામે વાંઘો લેનાર કોઈપણ વ્યક્તિ આ નોટિસન પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર સેન્ટ્રલ રિજ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિચન ઇન્ટ્રિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ), પ્લોટ નંબર ૬,७ અને ૮, સેક્ટર પ, આઇએમટી માનેસર જીલ્લા ગુડગાવ (હરિયાણા), પિન કોડ-૧૨૨૦૫૦ મા રિજેટ્ટ્રારને લેખિતમાં પોતાનો વાંદો ઉઠાવી શકે છે અને તેની એક નક્લ કંપની (પાર્ટનરશીપ ફર્મ) ને મોક્લવી.

તારીખ : ૦૫.૦૨.૨૦૨૪ સ્થળ : સુરત

અરજદારનું નામ પહલ સોલાર વતી, પરેશ ઘીરૂભાઈ શીંગાળા અધિકૃત સહીં કરનાર / ભાગીદાર



રજીસ્ટર્ડ ઓફીસ : બ્લોક નં. એ/૧૦૦૩, વેસ્ટ ગેટ, વાયએમસીએ ક્લ પાસે. સ.નં. ૮૩૫/૧+૩. એસ.જા. હાઈવે. મકરળા. અમદાવાદ – ૩૮૦૦૫ **કોર્પોરેટ ઓફીસ**ંસીએફએમ એસેટ રીકન્સ્ટ્રશન પ્રા. લી., પહેલો માળ વોકફીલ્ડ હાઉસ, સ્પ્રોટ રોડ, બાલાડ એસ્ટેટ, મુંબઈ-૪૦૦૦૩૮. ફોન નં. + ૯૧ ૨૨ ૪૦૦૫૫૨૮૨, CIN: U67100GJ2015PTC083994

પઝેશન નોટીસ (સ્થાવર મિલકત માટે)

દ્યી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એક્ટ), ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) તથા કલમ ૧૩(૧૨), ૧૩(૨) હેઠળ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ના નિયમ ૩ અંતર્ગત વંચાર્ણ લેતા મળેલી સત્તાના રૂએ તા. ૦૪.૦૫.૨૦૨૦ ના રોજ માંગણા નોટીસ જારી કરી ઉધારકર્તા / ગિરવેદાર / જામીનદારોના – ૧ શ્રી નિતાંત જગદીશચંદ્ર ચોવ્હા અને ધ્યાનન નિતાંત ચોવ્હા અને ક્ષમા નિતાંત ચોવ્હા (ઉધારકર્તા અને ગિરવેદાર) **૨. શ્રી જીવણભાઈ દેવશીભાઈ બાબરીયા** (જામીનદાર) **૩. શ્રી પ્રકાશચં**દ્ર **અંબાલાલ પંડ્યા** (જામીનદાર) ને માંગણા નોટીસ જારી કરીને નોટીસમાં જણાવેલ બાકી રકમ **રૂા. ૨૦,૫૦,૬૮૦/-** (રૂા. વીસ લાખ પચાસ હજાર છસ્સો એશી ફક્ત) તા. ૩૦.૦૪.૨૦૨૦ ના રોજ બાકી વત્તા ચડત વ્યાજ સાથે કોસ્ટ ચાર્જાસ ખર્ચા થયેલ નોટીસ મળ્યાના ૬૦ દીવસની અંદર ભરવા જણાવેલ હતું.

વધુમાં ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લીમીટેડ એ સીએફએમ એસેટ રીકન્સ્ટ્રકશન પ્ર લી. તરફેણમાં તેના તમામ અધિકારો, શિર્ષક અને ઉપરોક્ત લોન ખાતાના બાકી સમગ્ર દેવાના વ્યાજની સાથે **તા. ૨૬.૦૩.૨૦૨૧** ના રોજ એસાઈનમેન્ટ એગ્રીમેન્ટના અનુસંધાને ધ મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લીમીટેડ અને સીએફએમ એસેટ રીકન્સ્ટ્રકશન પ્રા. લી. ને સરફેસી કાયદા ૨૦૦૨ ની કલમ ૫ હેઠળ સોપેલ છે.

ઉદ્યારકર્તા સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદ્યારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સદરહુ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૪) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૮ સાથે વંચાણે લેતાં આપેલી સત્તા ની રૂએ અદ્યોહસ્તાસરીએ નીચે જણાવેલ મુકરર મિલકતનો **તા. ૦૪.૦૨.૨૦૨૪** ના રોજ **પ્રત્યક્ષ કબજો**

ઉદ્યારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકતો અંગે કોઇપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ રહ્યાંથી મિલકતો અંગે કરેલો કોઇપણ વ્યવહાર **સીએકએમ એસેટ રીકન્સ્ટ્રશન પ્રાઇવેટ લીમીટેડ** માટે રકમ **રૂા. ૨૦,૫૦,૬૮૦/**- (રૂા. વીસ લાખ પચાસ હજાર છસ્સો એશી ફક્ત) તા. 30.0૪.૨૦૨૦ ના રોજ બાકી અને તેની ઉપરન વ્યાજ એટલે કે તા. ૦૧.૦૫.૨૦૨૦ વત્તા અન્ય ખર્ચાઓ. (કલમ ૧૩(૨) હેઠળની ડીમાન્ડ નોટીસ આપ્યા પછી જમા કરેલ રકમની ઈફેકટ આપેલ છે).

"સદરહુ કાયદાની કલમ ૧૩ની પેટા–કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાનું મુકરર મિલક્ત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

સ્થાવર મિલક્તનનું વર્ણન નિતાંત જગદીશચંદ્ર યોદ્ધા, ધ્યાનન નિતાંત યોદ્ધા અને કરમા નિતાંત યોદ્ધાની માલિકીની સ્થાવર મિલકત – ફ્લેટ નં. 3/આઇ/૨૦૪, રજો માળ, શ્રી બાલાજી સ્ટેટસ, વાઈડ એંગલ પાસે, ખારી નદી પાસે, હાઇવે રોડ ક્ષેત્રફળ ૧૭૩.૯૧ સ્કે.મીટર એટલે કે ૨૦૮ સ્કે.ચાર્ડ રેવન્યુ સર્વે નં. ૪૮૫ ખાતે સ્થિત, જમીન ક્ષેત્રફળ ૧૫૨૭૬ સ્કે.મીટર, મોજે ગામ: નાગલપુર, ડિસ્ટ્રીક્ટ મેહસાણા અને સબ ડિસ્ટ્રીક્ટ મેહસાણા ખાતે આવેલ સમગ્ર મિલકત.

ચડત વ્યાજ સાથે બોજાને આધિન રહેશે.

LNHLSUR000042328

સુરત શાખા)

શ્રી રામશરણ બજરંગબલી મિશ્ર શ્રીમતી લલ્લુ રામશરણ મિશ્રા

ાળ . ઇ. હ. ૧૯૯૪ ૪ : મહેલાહા (સીએફએમએઆરસી ટ્રસ્ટ-૧ એમચુસીબીના ટ્રસ્ટી તરીકે તેની કાર્યક્ષમતામાં કાર્ય કરે છે)

કેપરી ગ્લોબલ હાઉસીંગ કાયનાન્સ લિમીટેડ CAPRI GLOBAL રજીસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસ: ૫૦૨, ટાવર - એ, પેનિનસુલા બિઝનેશ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ,

આથી, કેપરી ગ્લોબલ હાઉસીંગ ફાયનાન્સ લિમીટેડ (CGHFL) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ અંતર્ગત ઉધારકર્તાઓ / જામીનદારોને માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોની અંદરની બાકી રકમ સાથે ચુકવવા જણાવેલ. ઉધારકર્તાઓ સદરહ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉધારકર્તાઓ / જામીનદારો તથા જાહેર જનતા જણાવવામાં આવે છે કે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ની કલમ-૧૩ ની પેટા કલમ (૪) અંતર્ગત નિયમ ૮ સાથે વંચાણે લેતાં આપેલી સત્તાની રૂએ અદ્યોહસ્તાક્ષરીએ નીચે જણાવેલ મિલ્કતનો કબજો લઈ લીધો છે. ''સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉધારકર્તાનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે." ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર "CGHFL" ની રકમ ની બાકી રકમ અને

લોવર પરેલ, મુંબઈ - ૪૦૦૦૧ ૩. ઓફિસ સરનામું : નવમો માળ, બીબીસી ટાવર, લૉ ગાર્ડની સામે, એક્ષીસ બેંકની પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૬.

ક્લ્યા વોટીસ (પરિશિષ્ટ - ૪) (સ્થાવર મિલકતો માટે)

VALIANT COMMUNICATIONS LTD.

CIN: L74899DL1993PLC056652 Regd. Office: 71/1, Shivaji Marg, New Delhi-110015 Phone: +91-11-25928415, 25928416

Email: investors@valiantcom.com, Web: www.valiantcom.com NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING

NOTICE is hereby given that an Extraordinary General Meeting ('EGM') of the Members of Valiant Communications Limited ('Company') will be held on Thursday 29" February, 2024 at 10:00 a.m. (IST) through the Video Conferencing ('VC')/Other Audio Video Means ('OAVM'), without the physical presence of the Members at the meeting to transact the business(es) set out in the Notice for EGM, in accordance with the applicable provisions of the Companies Act, 2013, Rules and applicable Circulars issued by statutory authorities. In compliance with applicable Circulars, the Notice of the EGM has been sent by email to all the members whose email ids are registered with the Company/ Registrar and Share Transfer Agents (RTA)/ Depository Participants (DPs) The emailing of Notice of the EGM to all members has be The members attending the EGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

The Company is providing the remote e-Voting facility before the EGM and e-Voting facility at the EGM to its members to exercise their right to vote on all the resolutions proposed to be transacted at the EGM by electronic means and the facility being provided by Link Intime India Private Limited (LIIPL). Facility for e-Voting at the EGM will be made available to those Members who present in the EGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting. The Members who have cast their vote by remote e-Voting prior to the EGM may also attend/ participate in the EGM through VC/OAVM but shall not be entitled to cast their vote again. Detailed process of remote e-Voting, joining the EGM through VC/OAVM and e-Voting at the EGM by the members, has been provided in the Notice of the EGM.

- n case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depositories, please follow the below instructions to register e-mail address for obtaining login details for e-voting:
- Demat Holding: Members holding Equity Shares of the Company in demat form and who have not registered their email ids may temporarily register their email ids by clicking the link: https://www.valiantcom.com/corporate/investors/investors details.html and following the registration process as guided therein. In case of any query, a Member may send an email at investors@valiantcom.com. It is clarified that for permanent registration of email ids, Members are requested to approach their respective DPs and follow the process advised by DPs.
- Physical Holding: Members holding Equity Shares of the Company in physical form and who have not registered their email ids with the Company, are requested to register their email ids by submitting Form ISR-1 and other related forms with the RTAs i.e. Link Intime India Private Limited (LIIPL) at delta-limited (LIIPL) at <a href="delta-limited (LIIPL) at <a href an e-mail at investors@valiantcom.com.
- All the Members are informed that: The business as set forth in the Notice of the EGM will be transacted through voting by
- electronic means in the form of e-Voting. The remote e-Voting shall commence on Monday, Feb. 26th 2024 (10:00 a.m. IST) and ends on Wednesday, Feb. 28* 2024 (05:00 p.m. IST). The remote e-Voting facility shall be disabled by LIIPL thereafter and once the vote on a resolution is cast by a
- member, the member shall not be allowed to change it subsequently. Any person whose name is recorded in the register of members as on the cut-off date i.e. Thursday, Feb. 22^{et} 2024, only shall be entitled to vote through remote e-Voting, e-Voting at the EGM.
- Any person who becomes a member of the Company after sending the notice of the EGM and holding shares as on the cut-off date may obtain login ID and password by sending a request at enclose:@linkintime.co.in.
- The Notice of the EGM can be downloaded from the Company's website at www.valiantcom.com and on the website of the BSE Limited at www.bseindia.com and LIIPL website at https://instavote.linkintime.co.in.

Members who need assistance before or during the EGM, for any grievances connected with the facility for e-Voting, they can address them to instameet@linkintime.co.in or call on +91 (022) 4918 6175.

For Valiant Communications Limite

Manish Kumar

Place : New Delhi Date: February 05th, 2024

Company Secretary ICSI Membership No. A16483

તારીખ

સાંકેતિક

કબજો

રીટેલ લેન્ડીંગ એન્ડ પેમેન્ટ ગુપ (લોકર શાખા / શાખા) : એકિસસ બેંક લિમીટેડ, કલેકશન સેન્ટર, પહેલો માળ, યુનિટ નં. ૧૦૧ અને ૧૦૨ (ભાગ), બાલેશ્વર એવન્યુ, એસ.જી. હાઈવે, રાજપથ કલબની સામે, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૫૪. **એકિસસ બેંક લિમીટેડ** : ત્રીજો માળ, ગીગા પ્લેક્સ, એનપીસી-૧, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, મુગલસન રોડ, એરોલી, નવી મુંબઈ-૪૦૦૭૦૮. **૨જીસ્ટર્ડ ઓફિસ** : ત્રિશુલ, ત્રીજો માળ, સમર્થેશ્વર મંદિરની સામે, લો ગાર્ડન, એલીસબ્રીજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.

સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ

સિકયોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટેની ઈ-હરાજી . વેચાણ નોટીસ સિકયોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈ સાંથે વંચાણે લેતાં. આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકર્તાઓ અને જામીનદારોને સુચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત સુરક્ષીત લેણદાર પાસે મોગેંજ/ચાર્જ કરવામાં આવી છે. જેનો ભીતિક કબજો (નીચે વિગતવાર તરીકે) અધિકૃત અધિકારી દ્રારા લેવામાં આવ્યો છે. "જેમ છે ત્યા" "જેમ છે તેમ" અને "જે છે તે" પર સિકચોર્ડ ક્રેડીટરનું વેચાણ કરવામાં આવશે જેમાં તા. **૧૨.૦૩.૨૦૨૪** ના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી, (બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ અને સમય તા. **૧૧.૦૩.૨૦૨૪** ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી) નીચે દર્શાવેલ સંબંધિત ઉધારકર્તાઓ અને જામીનદારો પાસેથી એકિસસ બેંક સુરક્ષિત લેણદારને કારણે રકમની વસુલાત માટે (સંબંધિત કોલમમાં નીચે દર્શાવેલ છે). સંબંધિત કોલમમાં નીચે જણાવ્યા પ્રમાણે મિલકતોની અનામત કિંમત અને ઈએમડી ની રકમ.

ક્ર.	ઉધારકર્તા, મોર્ગેજરનું નામ અને શાખા	મિલકત / મકાનનું વર્ણન / આશરે કુલ વિસ્તાર	અનામત કિંમત	ઈએમડીની કિંમત	બીડ વધારવા ની સ્ક્રમ	બાકી લ્હેણીની સ્ક્રમ	સંપર્ક વ્યક્તિ
1	1.પરાલ હસમુખભાઈ શાહ 2.દિપ્તી પરાલ શાહ (લોન નં PCR000303824 891)	તમામ ભાગ અને હિસ્સા સાથે નો હોલ નં. 4 અને 5, રહેણાંક કમ્ કોમ્પ્લેક્સમાં ચોથા માળે, જે "શિવાનંદ આર્કેડ" તરીકે ઓળખાય છે, જેમાં હોલનો સુપર બિલ્ટ એરિયા છે, જે 4567 ચોરસ ફૂટ એટલે કે 424.44 ચોરસ મીટરમાં અવિભાજિત સામાન્ય જમીન ધરાવે છે, જે 181.25 ચોરસ મીટર જમીન સાથે આવક સર્વે નંબર 664, સર્વે નં 664/2, ટીપી સ્કીમ નંબર 5ના એક્પી નંબર 42, એફપી નંબર 42, મૌજે ગામ - ક્લોલ સિમ, તાલુકો - ક્લોલ, નોંધણી પેટા જિલ્લા - ક્લોલ, ગાંધીનગરનો નોંધણી જિલ્લો ખાતે અને હોવું. ચતુઃ સીમા - ઉત્તર : ખુલ્લી જગ્યા, દક્ષિણ : પેસેજ, પૂર્વ : માર્જિન, પશ્ચિમ : હોલ નંબર 3	ફ. ૧,૦૫,૮૪,૦૨ ૨/- (રૂપિયા એક કરોડ પાંચ લાખ યોર્યાસી	રુ. ૧૦,૫૮,૪૦૨/ - (રૂપિયા દસ લાખ અઠ્ઠાવન હજાર ચારસો બે)	- (રૂપિયા એક લાખ)ના	ર. ૧,૨૫,૦૪,૧૭૪/- (રૂપિયા એક	નામ :- શ્રી નિરવ ઝવેરી 9824383632 ઈ-મેઇલ ID:- nirav.zaveri@axisbank.co m અથવા નામ :- શ્રી સાગર કોટેચા 9909799027 ઈ-મેઇલ ID:- sagar.kotecha@axisbank. com.

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે, કૃપા કરીને તેમના વેબ પોર્ટલ પર સુરક્ષિત લેણદારની વેબસાઇટ એટલે કે https://www.axisbank.com/auction-retail અને બેંકની માન્ સેવા પ્રદાતા મેસર્સ સી1 ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પૂરી પાડવામાં આવેલી લિંકનો સંદર્ભ લો <u>https://www.bankeauctions.com</u> આ હરાજી બેંકની માન્ય સેવા પ્રદાતા મેસર્સ સી1 ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારફતે તેમના વેબ પોર્ટલ https://www.bankeauctions.com પર ઓનલાઇન હાથ ધરવામાં આવશે. અન્ય કોઇ પણ સહાય માટે, ઇચ્છુક બિડર્સ સ્વારે 11:30 થી બપોરે 3:00 વાગ્યા ની વચ્ચે અધિકૃત અધિકારીઓની નીચે સંપર્ક કરી શકે છે. બિડ ટ્રાન્સફરેબલ નથી.

આ નોટિસને સુરક્ષા હિત (અમલૅ બજવણી) નિયમ, 2002ના નિયમ 8(6) હેઠળ ઋણલેનારાઓર્ને 30 દિવસની નોટિસ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ

₹ in Lakhs

Sun Pharma Advanced Research Company Limited

Regd. Office: Plot No. 5 & 6/1, Savli, G. I. D. C. Estate, Savli - Vadodara Highway, Manjusar, Vadodara - 391 775.

Tel.: +91-2667 666800, CIN: L73100GJ2006PLC047837, Website: www.sparc.life

			Standalone			Consolic	Jated
Sr.	Particulars	Quarter ended Year ended 31.12.2023 30.09.2023 31.12.2022 31.03.202 Unaudited Unaudited Unaudited Audited 2,025 2,967 13,112 24,966 (tems) (9,965) (8,642) 1,015 (22,258) (9,965) (8,642) 1,015 (22,258) (9,965) (8,642) 1,015 (22,258) (9,931) (8,608) 1,057 (22,123) (9,931) (8,608) 1,057 (22,123) (set 48,032 48,032 (3.07) (2.66) 0.37 (7.82)			Year ended	Quarter ended	Half Year ended
No.	i di nodidi s		30.09.2023	31.12.2022	31.03.2023	31.12.2023	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited
1.	Total Income from Operations	2,025	2,967	13,112	24,966	2,025	2,967
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
3.	Net Profit / (Loss) for the period (before Tax and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
4.	Net Profit / (Loss) for the period (after Tax and / or Extraordinary Items)	(9,965)	(8,642)	1,015	(22,258)	(9,965)	(8,642)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss)	(9,931)	(8,608)	1,057	(22,123)	(9,931)	(8,608)
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)						I
6.	Paid up Equity Share Capital	3,245	3,245	2,753	3,245	3,245	3,245
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet				48,032		
8.	Basic Earning / (Loss) Per Share (of ₹ 1 each) (for continuing and	(3.07)	(2.66)	0.37	(7.82)	(3.07)	(2.66)
	discontinued operations)						
9.	Diluted Earning / (Loss) Per Share (of ₹ 1 each) (for continuing and	(3.07)	(2.66)	0.35	(7.82)	(3.07)	(2.66)
	discontinued operations)						·

Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2023

- i) The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for Quarter ended December 31, 2023 are available on the websites of the Stock Exchanges viz. www.bseindia.com, www.nseindia.com and of the Company viz. www.sparc.life
- i) There were no deviations in the utilisation of the funds raised through the Preferential Issue of warrants convertible into equity shares of the Company, from the objects as specified in the Notice of Extra-Ordinary General Meeting dated May 12, 2021.

Three months ended

For and on behalf of the Board Dilip S. Shanghvi Chairman

Mumbai, February 5, 2024

Three months ended

eMudhra Limited



ended

For the nine months ended

CORPORATE IDENTITY NUMBER: L72900KA2008PLC060368
Registered Office:Plot No 12-P1-A & 12-P1-B, Hi-Tech Defence and Aerospace Park (IT Sector) Jala Hobli BK Palya, Bengaluru - 562 149 Karnataka,India. www.emudhra.com|Telephone:080 – 4848 4046 (All amounts are in INR million, unless otherwise stated)

Un-audited Financial Results For The Quarter and nine months ended December 31,2023

For the nine months ended For the year

[[Regulation 52 (8), read with Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 (LODR Regulations)] Standalone

ended

31,2022 31,2023	23	Decembe 31,2023 (Un-Audite	December 31,2022 (Un-Audited)	September 30,2023 (Un-Audited	December 31,2023 (Un-Audited)	March 31,2023 (Audited)	December 31,2022 (Un-Audited)	December 31,2023 (Un-Audited)	December 31,2022 (Un-Audited)	September 30,2023 (Un-Audited)	December 31,2023 (Un-Audited)	Particulars	SI No.
6 1,173.81 1,640.22	9.56	1,249.5	440.60	531.61	453.98	2,487.57	1,719.46	2,734.27	612.42	963.00	973.78	Total Income from operations	1
212.77 269.77	88	114.88	57.32	143.61	5.19	733.79	529.87	632.94	180.05	230.38	204.74	Net Profit/(Loss) for the period (before tax, exceptional and /or extraordinary items)*	2
212.77 269.77	38	114.88	57.32	143.61	5.19	733.79	529.87	632.94	180.05	230.38		Net Profit/(Loss) for the period before tax, (after exceptional and /or extraordinary items)*	3
158.60 199.74	0	82.20	45.09	103.91	4.03	611.98	453.97	551.49	152.12	187.64		Net Profit/(Loss) for the period after tax (after exceptional and /or extraordinary items)	4
155.48 195.74	4	82.14	44.39	105.26	3.35	563.37	439.88	567.33	142.00	177.56	209.00	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5
390.36 390.36	36	390.36	390.36	390.36	390.36	374.87	390.36	379.69	390.36	378.65	379.69	Paid up Equity Share Capital	6
- 699.64		-	-	-	-	1,400.23	-	-	-	-	-	Reserves (excluding Revaluation Reserve)	7
- 1,857.43		-	-	-	-	1,857.43	-	-	-	-	-	Securities Premium Account	8
- 3,197.43		-	-	-	-	3,924.14	-	-	-	-	-	Net worth	9
		-	-	-	-	-	-	-	-	-	-	Paid up Debt Capital/ Outstanding Debt	10
-		-	-	-	-		-	-	-	-	-	Outstanding Redeemable Preference Shares	11
		-	-	-	-		-	-	-	-	-	Debt Equity Ratio (Percentage)	12
												Earnings Per Share (face value of Rs.5/- each)** (for continuing and discontinued	
2.07 2.60	05	1.05	0.59	1.33	0.05	8.35	5.99	7.12	2.00	2.43	2.65	Basic	
2.07 2.60	05	1.05	0.59	1.33	0.05	8.01	5.99	6.93	2.00	2.35	2.58	Diluted	13.2
		-	-	-	-	283.43	-	-	-	-	-	Capital Redemption Reserve	14
- 250.00							1	1	I .	1	1	Dobonturo	1 1
	_	1.05	0.59	1.33	0.05	8.01	5.99	6.93	2.00	2.35		Basic Diluted Capital Redemption	13.1 13.2

There was no exceptional and extra ordinary items during the above mentioned year

Notes:

- 1. The above results have been reviewed by the audit committee and approved by Board of Directors at their meeting held on February 05,2024
- 2. The above is an extract of the detailed format of quarterly/ annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the quarterly/ annual financial results is available on the websites of the Stock Exchange's, (www.bseindia.com and nseindia.com) and the listed entity website (www.emudhra.com).
- 3. The full format of the Un-audited financial results are available in stock exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the company website(www.emudhra.com).

Date: February 05,2024

By order of the Board for eMudhra Limited Sd/-V Srinivasan Executive Chairman

ઉદ્યારકર્તા/જામીનદારનું નામ **સિક્યોર્ડ એસેટ્સનું વર્ણન (स्थावर भि**લક્ત) તારીખ અને રકમ જીલ્લો અને પેટા જીલ્લો જામનગરમાં ગામ ઢીંચડા ખાતે જમીન ઘરાવતુ <mark>૧७.૧૧.૨૦૨૩</mark> (Loan Account No. બાર.એસ.નં.૩૯/પૈકી ૭, ક્ષેત્રફળ ૧૧૮૩૭ સ્કે.મીટર, જામનગર એરિય LNHLJAM000013854 ડેવલપમેન્ટ ઓથોરિટીએ લેઆઉટને મંજૂરી આપી છે અને કલેક્ટર જામનગર બિનખેતીની જમીનમાં ફેરવલ, જમીન અને લેઆઉટ મુજબ આ જમીન ૧ થી | જામનગર શાખા) ૮૩ રહેણાંકમાં વહેચાયેલી **"ઓમ સાંઇ રામ પાર્ક-બી"** તરીકે ઓળખાત પ્લો. ઓમ સાંઈ રામ પાર્ક -બી ના આ પ્લોટમાંથી પ્લોટ નંબર ૨૦ અને ૨૧ શ્રીમતી નીતાબેન ઘનશ્ચામભાઈ ભ હતા. જે ભેળવીને નવો પ્લોટ નં.૨૦ અને નવો પ્લોટ નં. ૨૦ હતો. સબપ્લોટ બને ૩ પેટા પ્લોટમાં વિભાજિત એટલે કે, ૨૦/૧ થી ૨૦/૩ દ્વારા જામનગ મહાનગરપાલિકાની મંજૂરીથી. ઓમ સાંઈ રામ પાર્ક - બી ના આ પ્લોટ પૈકી [ા]લોટ નં. ૨૦/૨, ક્ષેત્રફળ પ્લોટ એરીયા ૬૪.૦૯ ચો.મીટર, બંસીધર સ્કુલની સામે, બેડી બંદર રોડ, ઢીંચડા, સિટી, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૬ **ચતુઃસીમા**ઃ-**પૂર્વે**ઃ પ્લોટ નં. ૪૦ અને ૪૧ જે સ્થિત, પશ્ચિમે ઃ જે સ્થિત છે.પ૦ મીટર પહોળો રોડ, **ઉત્તરે** ઃ જે સ્થિત સબ પ્લોટ નં. ૨૦/૧, **દક્ષિણે** જે સ્થિત સબ પ્લોટ નં. ૨૦/૩. (Loan Account No. ૭લ્લો અને સબ જીલ્લો જામનગરમાં, ગામ મુંગની, મૂળ જમીન નો આર.એસ. નં. ૨૪૩, ક્ષેત્રફળ ૩૭૯૩૯.૦૦ સ્કે.મી., ક્ષારા બિનખેતીના રહેણાંક પ્લોટમાં રૂપાંતરિત કરવામાં બાવ્યું હતું. જે વાડીનાર વિસ્તાર વિકાસ સત્તામંડળ અને કલેક્ટરનો આદેશ જામનગર. આ LNHLJAM000012494 લોટ પૈકી નં.૪૧ થી ૫૩ અને ભેળવીને નવો પ્લોટ નં. ૪૧ આપવામાં આવ્યો હતો અને જામનગર શાખા) વા પ્લોટ નં. ૪૧ને વાડીનાર વિસ્તારની મંજુરીથી ૨૩ પેટા પ્લોટ, સબ પ્લોટ નં. ૪૧/૧ શ્રી કલદીપસિંહ મનજાતસિંહ થી ૪૧/૨ ૩માં વહેંચવામાં આવ્યો હતો. વિકાસ સત્તામંડળ, આ સબ પ્લોટ પૈકી સબ પ્લો C/o. મે.આદિત્ય એન્ટરપ્રાઈઝ i. ૪૧/૬, વિસ્તાર માપણી ૬૫.૬૩ ચો.મીટર, ચિત્રકુટ, મારૂતિનગર પાછળ, બંધ ટીપી એસ રોડ, વિસ્તાર ચિત્રકુટ મુંગની, શહેર સિક્કા, તાલુકા અને જિલ્લો જામનગર, ગુજરાત ૩૬૧૧૪૧. **ચતુઃશ્રીમા**ઃ-**પૂર્વ** : ૭.૫૦ મી. પહોળો રોડ, **પશ્ચિમે** : સબ પ્લોટ પ્રીમતી લખવિંદર મનજીતસિંહ કૌ નં.૪૧/૧૯, અને ૪૧/૨૦, **ઉત્તરે** : સબ પ્લોટ નં.૪૧/૫ , **દક્ષિણે** :સબ પ્લોટ નં.૪૧/૭ ામામ ભાગ અને હિસ્સા સાથેની જમીન પર રેસીડેન્સીયલ પ્લોટ યુનિટ-એ,

સાંકેતિક 02.02.2027 LNCGHGNDHL000000079 એરીયાનું ક્ષેત્રફળ ૫૦.૭૫ સ્કે.મી., દક્ષિણ બાજુનો ભાગનો પ્લોટ નં.૬૪ સાંકેતિક આર.એસ.નં.૧૯૩/પૈકી/૯/પૈકી ૧, ગામ ગોકુલધામ, સ્વામીનારાયણનગર ગાંધીધામ શાખા) પ,૧૬,૩૫૩/-શ્રી ભરતનાથ દયાનાથ પાછળ, સત્તાપર રોડ, રાતા તળાવ, તાલુકા અંજાર, જીલ્લો-કચ્છ, ગુજરાત[.] ૩૭૦૧૧૦. **ચતુઃસીમા**ઃ-**પૂર્વે** : ૯ મીટર પહોળો રોડ, **પશ્ચિમે** : પ્લોટ C/o. મે. આદેશ RTO સલાહકા નં.૪૨, **ઉત્તરે** ઃ ઉત્તર બાજુનો ભાગનો પ્લોટ નં. ૬૪, **દક્ષિણે** ઃ પ્લોટ તમામ ભાગ અને હિસ્સા સાથે મિલકતનો ફ્લેટ નં. ૩૦૩, બ્લોક એલ, ત્રીજો માળ, २૯.११.२०२३ 02.02.202 (Loan Account No ક્ષેત્રફળ આશરે ૧૦૮.૬૯ સ્કે.મી. સુપર બિલ્ટઅપ-એરીયા અને અવિભાજય ભાગ ૩૬.૦૦ સ્કે.મી., આદિત્ય ઈન્ડિયાકોલોની સ્ક્રીમ થી જાણીતી, જેનું બાંધકામ LNHLAHE000017327 સાંકેતિક કે જમીન પર થયેલ તેનો સબ પ્લોટ નં. ૩ અને ૪, ફાઈનલ પ્લોટ નં. **૯૭** અમદાવાદ શાખા) ૧૦૧+ ૧૦૬/૨ અને ૧૦૫/૧, ટીપી સ્કીમ નં.૭૬, એકીકૃત બ્લોક નંબર श्री भनीष आत्मप्रसाह राજपूत ૧૭૬/એ (જુનો બ્લોક નંબર ૧૭૭, ૧૭૯,૧૯૬ અને ૧૭૬/ર), સ્વામિનારાયણ વિદ્યાધામ પાસે, મોજે હાથીજણ વટવા, અમદાવાદ, ગુજરાત-૩૮૨૪૪૫. ચતુઃસીમાઃ-પૂર્વે : ફ્લેટ નં.-એલ-૩૦૪, પશ્ચિમે : બ્લોક નં.ડી, ઉત્ત≷ : સોસાયટી શ્રીમતી મીનાદેવી આત્મસિંહ રાજપૂત મન રોડ, **દક્ષિણે** : ફલેટ નં. એલ-૩૦૨. તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકત બિન-ખેતી લાયક અને રહેઠાણ લાયક (Loan Account No તમાન ખાગ જો પહેરતા સાવેગા ભાગકા ભગવાના લાવક ગ પહેરાકો સાવેદ સબ-પ્લોટ નં. ૩૬ થી ૪૧/આઈ, પ્લોટ એરીયા ક્ષેત્રફળ આશરે ૬૮.૮૬ સ્કે.મીટર એકીકૃત મુખ્ય પ્લોટ નં.૩૬ થી ૪૧, "ગંજાનંદ સિલ્વર સિટી" રેવન્યુ સર્વે નંબર ૧૦૫/પૈકી ૧, ગામ બારોઈ તાલુકો મુદ્રા, જીલ્લો કચ્છ, ગુજરાત-૩૭૦૪૨૧. **ચતુઃસીમા**ઃ**મૂર્વે**: ૬.૦૦ મીટર પહોળો આંતરિક રોડ, પ**શ્ચિમે**: LNHLGND000027938 ગાંધીધામ શાખા) શ્રી હરજી હરશી ઘેડા કબજો ८,२२,७६४/-C/o.શ્રી ઉમા કેબ્રિકેશન્સ શ્રીમતી રત્નાબાઈ હરીજી મ ાબ પ્લોટ નં.૩૬-૪૧/એ, **ઉત્તરે** ઃ ૭.૫૦ મીટર પહોળો આંતરિક રોડ, **દક્ષિણે** ીમતી મહેશ્વરીવરી રાલનબાઇ હીઇ સબ પ્લોટ નં. ૩૬-૪૧/જે. તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો બિન-ખેતી લાયક પ્લોટની જમીન 06.06.2023 ०४.०२.२०२१ (Loan Account No મોજે ઘલુડી, જે જમીનનો રેવન્યુ સર્વે નં. ૭૩, બ્લોક નં. ૬૩/એ, (ફરી સર્વે થયા પછી નવો બ્લોક નં.૮૦) પીનલ રેડીડેન્સીથી ઓળખાતી પૈકી પ્લોટ નં. ૨૫૮, LNHLSUR000062677 લોટનું ક્ષેત્રફળ ૬૦.૨૩ સ્કે.મી., અવિભાજ્ય ભાગે પડતી જમીનનું ક્ષેત્રફળ ૧૬,૦૫,૪૬૫/ શ્રી નરેશભાઈ બાબુભાઈ ડાભી ૩૩.૩૯ સ્કે.મી., કુલ ક્ષેત્રફળ ૯૩.૬૨ સ્કે.મી, મ્યુ.ઈન્ટરનેશનલ સ્કુલ પાસે શ્રીમતી સોનલ નરેશભાઈ ડાર્ભ વેલનજી કેનાલ રોડ, ઘલુડી, કામરેજ, સુરત, ગુજરાત-૩૯૪૧૩૦. **ચતુઃસામ** -**પૂર્વે** : પ્લોટ નં. ૨૪૯, પશ્ચિમે : સોસાયટી ઈન્ટરનલ રોડ, **હત્તરે** : પ્લોટ નં શ્રી ધીરુભાઈ બાબુભાઈ ડાભી .૫૭, **દક્ષિણે** : પ્લોટ નં. ૨૫૯. તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતો પ્લોટ નં. ૧૭૮, ક્ષેત્રફળ આશરે ૭૪ સ્કે.યાર્ડ, સાથે અવિભાજ્ય પ્રમાણસર ભાગ, જે જુમીન માટેનો રોડ અને સીઓથી 19.06.2023 08.02.202

ર૧.૯૩ લ્ક.ના./જનન વુગ વના ૧ ૧૧, ૧૧, ૧૧, ૧૧, ૧૧, ૧૧, ૧૧, ૧૫**૦** તાલુકા કામરેજ, જીલ્લો સુરત, ગુજરાત-૩૯૪૩૧૦. **ચતુઃસીમા ઃ-પૂર્વે** સોસાસટીનો આંતરિક રસ્તો, પ**શ્ચિમ** ઃ પ્લોટ નં. ૧૯૩, **ઉત્તરે** ઃ પ્લોટ નં. ૧૭૭ તારીખ : ૦૬.૦૨.૨૦૨૪ નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે) કેપરી ગ્લોબલ હાઉસીંગ ફાયનાન્સ લિમીટેડ

ક્ષેત્રફળ આશરે ૩૭.૯૨ સ્કે.મી., શ્રી વલ્લભ રેસીડેન્સી જાણીતી સોસાયટી જે સ્થિત હલઘરુ જેનો રેવન્યુ સર્વે નં.૧૪૬/૨ અને ૧૪૯, બ્લોક નં. ૧૭૦ પછીથી રેવન્યુ તવો બ્લોક નં.૧૮૪ (જે કે.જે.પી., બ્લોક નં. ૧૮૪/૧૭૮, ક્ષેત્રફળ આશરે

૧.૯૩ સ્કે.મી.)એપલ પુલ વિલાની સામે, હલઘરુ મોટા રોડ, ગામ હલઘરુ

સહી/- (અધિકૃત અધિકારી)

૧૫,૨૮,૨૯७/